

B.Ed. Semester - 3 (CBCS) Examination
Nov/Dec-2023 (OLD COURSE)
ELEMENTS OF ACCOUNT(ELECTIVE 1)

Time: 1:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો. (૦૮)
1. ભાગીદારીની વ્યાખ્યા આપો.
 2. વેપાર ખાતું એટલે શું?
 3. પાછડી એટલે શું?
 4. ભાગીદારીનું વિસર્જન એટલે શું?
- પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ૪ પ્રશ્નોના ઉત્તર આપો. (૫ માંથી ૪) (૧૨)
1. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ જણાવો.
 2. નોંધ લખો: ભાગીદારી કરારનામું
 3. પાછડીના મૂલ્યાંકનની સરેરાશ નફાની પદ્ધતિ સ્પષ્ટ કરો.
 4. ભાગીદારોમાં નફા-નુકસાનના પ્રમાણમાં ફેરફારના કારણો જણાવો.
 5. ભાગીદારના નિવૃત્તિના સંજોગો જણાવો.
- પ્રશ્ન.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ૩ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. (૫ માંથી ૩) (૧૫)
1. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ સમજાવો.
 2. નફા નુકસાન ખાતું નમુના સાથે સમજાવો.
 3. પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? નમુનો આપી સ્પષ્ટ કરો.
 4. ભાગીદાર પ્રવેશની અસરો જણાવો.
 5. ભાગીદારી પેઢી વિસર્જનની રીત સ્પષ્ટ કરો.

ENGLISH VERSION

- Que.1 answer each of the following in brief. (08)
1. give definition of partnership?
 2. What is trading account?
 3. What is Good will?
 4. What is dissolution of partnership?
- Que.2 Give answer of any 4 from the following 5. (12)
1. Explain objectives for prepare final accounts of partnership.
 2. write note: partnership deed.
 3. State average profit method for goodwill valuation.
 4. State the reasons for the change in the profit-loss ratio among the partners.
 5. State circumstances of retirement of a partner.
- Que.3 Answer any 3 from the following 5 in detail. (15)
1. Explain fluctuating capital account method.
 2. Explain profit and loss account with specimen.
 3. What is revaluation account? Explain with specimen.
 4. Explain effect of admission of a new partner.
 5. explain dissolution method of partnership firm.
